

Bhayaanak oont (Gujarati)

ભયાનક ઊંટ



સંપર્ક: ૧૧૯૧૦૬

ભયાનક ઊંટ

www.dawateislami.net

مکتبۃ الدینی
(دعوتِ اسلامی)

શ્રીમે તરીકત, અમીરે અહેલે સુન્નાત, ડાહિયે દા'વે કરવાની, હાજરત અલ્યામા મૌલાના અબૂ રિયાઝ

મુહમ્મદ ઇબ્રાહીમ અત્તાર કાદિરી ર-ઝવી

دعوتِ برکاتہم الوالیہ

“ભયાનક ઊંટ”

યેહ રિસાલા (ભયાનક ઊંટ)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઇસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ **عبدالله بن محمد بن عبد الله** ને ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી) ને ઇસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઇસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઇ-મેઇલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઇયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી)

મક-ત-બતુલ મદીના

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને, તીન દરવાઝા,

અહમદઆબાદ-1, ગુજરાત, ઇન્ડિયા

MO. 9374031409

E-mail : translationmaktabhind@dawateislami.net

કિયામત કે રોઝ હસરત

ફરમાને મુસ્તફા **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** : સબ સે ઝિયાદા હસરત કિયામત કે દિન ઉસ કો હોગી જિસે દુન્યા મેં ઇલ્મ હાસિલ કરને કા મૌકઅ મિલા મગર ઉસ ને હાસિલ ન કિયા ઓર ઉસ શખ્સ કો હોગી જિસ ને ઇલ્મ હાસિલ કિયા ઓર દૂસરોં ને તો ઉસ સે સુન કર નફ્રઅ ઉઠાયા લેકિન ઇસ ને ન ઉઠાયા (યા'ની ઉસ ઇલ્મ પર અમલ ન કિયા)

(તારિખ દેમશ્ક લાબન દેસાક્રજ ૧૦૧૩૮ વ. ૧૩૮૧ દારાલફકર બિરોત)

કિતાબ કે ખરીદાર મુ-તવજ્જેહ હોં

કિતાબ કી તબાઅત મેં નુમાયાં ખરાબી હો યા સફહાત કમ હોં યા બાઇન્ડિંગ મેં આગે પીછે હો ગએ હોં તો મક-ત-બતુલ મદીના સે રુજૂઅ ફરમાઇયે.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ભયાનક ઊંટ¹

શૈતાન લાખ સુસ્તી દિલાએ યેહ બયાન (32 સફહાત) આબિર તક પઠ
લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ સવાબ વ મા'લૂમાત કા ઢેરો ખઝાના હાથ
આએગા.

દુરૂદે પાક કી ફઝીલત

મદીને કે સુલ્તાન, રહમતે આ-લમિયાન, સરવરે ઝીશાન,
મહબૂબે રહમાન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને અ-ઝમત નિશાન
હે : જિસે કોઈ મુશ્કિલ પેશ આએ ઉસે મુઝ પર કસરત સે દુરૂદ પઠના
ચાહિયે ક્યૂંકે મુઝ પર દુરૂદ પઠના મુસીબતોં ઓર બલાઓં કો ટાલને
વાલા હૈ.

(الْقَوْلُ الْبَدِيْعُ ص ٤١٤، بَسْتَانُ الْوَاعِظِيْنَ لِلْجَوْزِيِّ ص ٢٧٤)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ عَلِيَّ مُحَمَّدٍ

﴿1﴾ ભયાનક ઊંટ

કુફરકારે કુરૈશ એક દિન કા'બએ મુશરફકા મેં જમ્મ થે, નબિયે
અકરમ, નૂરે મુજસસમ, શાહે આદમ વ બની આદમ, રસૂલે
મુહુતશમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ભી કરીબ હી નમાઝ અદા ફરમા રહે થે,

1 : યેહ બયાન અમીરે અહલે સુન્નાત وَدَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ ને તબ્લીગે કુરઆનો સુન્નાત કી
આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઇસ્લામી કે સુન્નાતોં ભરે ઇજતિમાઅ મેં
ફરમાયા થા. તરમીમ વ ઈજાફે કે સાથ તહરીરન હાઝિરે ખિદમત હે.

મજલિસે મક-ત-બતુલ મદીના

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જિસ نے મુઝ પર એક બાર દુરુદ પાક પઢા અલ્લાહ اَعَزَّوَجَلَّ اِیْسے پر دس
 رَحْمَتوں بے جتا ہے. (س)

અબૂ જહ્લ એક ભારી પથ્થર ઉઠા કર દુખિયા દિલોં કે ચૈન, રહમતે કૌનૈન, રસૂલે સ-કલૈન, નાનાએ હ-સનૈન صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કે સરે મુબારક કો سَجْدَةَ اللَّهِ કી હાલત મેં કુચલને કે નાપાક ઈરાદે સે આગે બઢા ઔર જૂં હી નઝદીક પહોંચા તો એક દમ બોખલા કર પીછે કી તરફ ભાગા, કુફરારે ના હન્જાર ને હૈરત સે પૂછા : અબુલ હકમ ! તુઝે ક્યા હુવા ? બોલા : મેં જૂં હી કરીબ પહોંચા મેરે તો ઔસાન હી ખતા હો ગએ, મેં ને દેખા કે એક દહ્શત નાક સર ઔર ખૌફનાક ગરદન વાલા ભયાનક ઊંટ મુંહ ખોલે દાંત કિચ-કિચાતા હુવા મુઝે હડપ કરને કે લિયે આગે બઢ રહા હૈ ! એસા ભયાનક ઊંટ મેં ને આજ તક નહીં દેખા. સરકારે દોટી આલમ, નૂરે મુજસ્સમ, શાહે આદમ વ બની આદમ, રસૂલે મુહ્તશમ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ને ફરમાયા : વોહ જિબ્રાઈલ (عَلَيْهِ السَّلَام) થે, અગર અબૂ જહ્લ ઔર નઝદીક આતા તો ઉસે પકડ લેતે.

(السِّيَرَةُ النَّبَوِيَّةُ لابن هشام ص ۱۱۷)

નૂરે ખુદા હૈ કુફ કી હ-ર-કત પે ખન્દા ઝન¹ (1 : હંસને વાલા)

ફૂંકોં સે યેહ ચરાગ બુઝાયા ન જાએગા

صَلُّوْا عَلٰی الْحَبِیْبِ ! صَلَّی اللہُ تَعَالٰی عَلٰی مُحَمَّدٍ

વાહ રે ! શાને બે નિયાઝી

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અલ્લાહ اَعَزَّوَجَلَّ કી શાને બે નિયાઝી ભી ખૂબ હૈ ! કભી અપને મહબૂબ મુબલિગ કો દુશ્મનોં કે ઝરીએ મસાઈબો આલામ મેં મુખ્તલા કર કે ઈન કે ખૂબ ખૂબ

ફરમાને મુસ્તફા સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ : જો શબ્દ મુઝ પર દુરૂદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્મત કા રાસ્તા ભૂલ ગયા. (ખીરુન)

દ-રજાત બુલન્દ ફરમાતા હૈ તો કભી મુબલ્લિગે આ'ઝમ, રહમતે દો^૨ આલમ સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ કે દુશ્મન કો વાર કરને સે કબ્લ હી ખૌફઝદા કર કે યેહ બાવર કરા દેતા હૈ કે કહીં હમારે મહબૂબ સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ કો અકેલા મત સમઝ બૈઠના !

આકાએ મઝલૂમ કો સતાને કા સબબ

હમારે આકાએ મઝલૂમ, સરવરે મા'સૂમ સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ પર કુફરારે બદ અત્વાર કે ઝુલ્મો સિતમ કા સબબ સિફ યેહી થા કે અબ આપ સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ ખુલ કર લોગોં કો નેકી કી દા'વત પેશ કરને લગે થે, જબ કે ઈબ્તિદાઅન સચ્ચિદુલ મુબલ્લિગીન, રહમતુલ્લિલ આ-લમીન સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ ને તીન^૩ સાલ તક ખુફયતન (યા'ની છુપ કર) ઈસ્લામ કી દા'વત દી, ફિર અલ્લાહ (અલ્લાહ) કી જાનિબ સે અલલ એ'લાન તબ્લીગ કા હુકમ હુવા. (અલ્લાહ) (૧૦૨)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

﴿2﴾ કોહે સફા સે નેકી કી દા'વત

પારહ 19 સૂ-રતુશ્શુ-અરાઅ આયત નમ્બર 214 મેં ઈશાદિ રબ્બાની હે :

وَأَنْذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ ﴿٢١﴾ તર-જ-મએ કન્ઝુલ ઈમાન : ઔર એ મહબૂબ અપને કરીબ તર રિશ્તેદારોં કો ડરાઓ.

ઈસ હુકમે ખુદા વન્દી પર હમારે આકાએ ક-રશી, મૌલાએ હાશિમી સલ્મુ અલ્લાહુ અલૈહી વસલ્મુ ને કોહે સફા પર જલ્વા ફિગન હો કર કબીલએ કુરૈશ કો પુકારા. જબ લોગ જમ્મ હો ગએ તો ઈશાદિ ફરમાયા :

ફરમાને મુસ્તફી ﷺ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पड़ा तबकीक वोह बढ भप्त हो गया. (उर्न)

બતાઓ અગર મેં તુમ સે કહૂં કે વાદિયે મક્કા સે એક લશ્કર હમ્લા આવર હોના ચાહતા હૈ તો કયા તુમ ચકીન કર લોગે ? સબ બ-ચક ઝબાન બોલ ઉઠે : કયૂં નહીં ! હમ ને તો હમેશા આપ (ﷺ) કો સચ બોલતે હી દેખા હૈ. મુબલિગે આ'ઝમ, રહમતે દો² આલમ, નૂરે મુજસ્સમ, શાહે બની આદમ, નબિય્યે મુહ્તશમ, શાફેએ ઉમમ ﷺ ને ઈશાદિ ફરમાયા : “તો સુન લો ! અગર તુમ મુઝ પર ઈમાન નહીં લાઓગે તો તુમ પર સખ્ત અઝાબ નાઝિલ હોગા.” યેહ સુન કર અબૂ લહબ બકવાસ કરને લગ ગયા ઓર લોગ મુન્તશિર હો ગએ. (بخاری ج ۳ ص ۲۹۶ حدیث ۴۷۷۰، ۴۷۷۱، ۴۷۷۲، ۴۷۷۳، ۴۷۷۴، ۴۷۷۵، ۴۷۷۶، ۴۷۷۷، ۴۷۷۸، ۴۷۷۹، ۴۷۸۰، ۴۷۸۱، ۴۷۸۲، ۴۷۸۳، ۴۷۸۴، ۴۷۸۵، ۴۷۸۶، ۴۷۸۷، ۴۷۸۸، ۴۷۸۹، ۴۷۹۰، ۴۷۹۱، ۴۷۹۲، ۴۷۹۳، ۴۷۹۴، ۴۷۹۵، ۴۷۹۶، ۴۷۹۷، ۴۷۹۸، ۴۷۹۹، ۴۸۰۰، ۴۸۰۱، ۴۸۰۲، ۴۸۰۳، ۴۸۰۴، ۴۸۰۵، ۴۸۰۶، ۴۸۰۷، ۴۸۰۸، ۴۸۰۹، ۴۸۱۰، ۴۸۱۱، ۴۸۱۲، ۴۸۱۳، ۴۸۱۴، ۴۸۱۵، ۴۸۱۶، ۴۸۱۷، ۴۸۱۸، ۴۸۱۹، ۴۸۲۰، ۴۸۲۱، ۴۸۲۲، ۴۸۲۳، ۴۸۲۴، ۴۸۲۵، ۴۸۲۶، ۴۸۲۷، ۴۸۲۸، ۴۸۲۹، ۴۸۳۰، ۴۸۳۱، ۴۸۳۲، ۴۸۳۳، ۴۸۳۴، ۴۸۳۵، ۴۸۳۶، ۴۸۳۷، ۴۸۳۸، ۴۸۳۹، ۴۸۴۰، ۴۸۴۱، ۴۸۴۲، ۴۸۴۳، ۴۸۴۴، ۴۸۴۵، ۴۸۴۶، ۴۸۴۷، ۴۸۴۸، ۴۸۴۹، ۴۸۵۰، ۴۸۵۱، ۴۸۵۲، ۴۸۵۳، ۴۸۵۴، ۴۸۵۵، ۴۸۵۶، ۴۸۵۷، ۴۸۵۸، ۴۸۵۹، ۴۸۶۰، ۴۸۶۱، ۴۸۶۲، ۴۸۶۳، ۴۸۶۴، ۴۸۶۵، ۴۸۶۶، ۴۸۶۷، ۴۸۶۸، ۴۸۶۹، ۴۸۷۰، ۴۸۷۱، ۴۸۷۲، ۴۸۷۳، ۴۸۷۴، ۴۸۷۵، ۴۸۷۶، ۴۸۷۷، ۴۸۷۸، ۴۸۷۹، ۴۸۸۰، ۴۸۸۱، ۴۸۸۲، ۴۸۸۳، ۴۸۸۴، ۴۸۸۵، ۴۸۸۶، ۴۸۸۷، ۴۸۸۸، ۴۸۸۹، ۴۸۹۰، ۴۸۹۱، ۴۸۹۲، ۴۸۹۳، ۴۸۹۴، ۴۸۹۵، ۴۸۹۶، ۴۸۹۷، ۴۸۹۸، ۴۸۹۹، ۴۹۰۰، ۴۹۰۱، ۴۹۰۲، ۴۹۰۳، ۴۹۰۴، ۴۹۰۵، ۴۹۰۶، ۴۹۰۷، ۴۹۰۸، ۴۹۰۹، ۴۹۱۰، ۴۹۱۱، ۴۹۱۲، ۴۹۱۳، ۴۹۱۴، ۴۹۱۵، ۴۹۱۶، ۴۹۱۷، ۴۹۱۸، ۴۹۱۹، ۴۹۲۰، ۴۹۲۱، ۴۹۲۲، ۴۹۲۳، ۴۹۲۴، ۴۹۲۵، ۴۹۲۶، ۴۹۲۷، ۴۹۲۸، ۴۹۲۹، ۴۹۳۰، ۴۹۳۱، ۴۹۳۲، ۴۹۳۳، ۴۹۳۴، ۴۹۳۵، ۴۹۳۶، ۴۹۳۷، ۴۹۳۸، ۴۹۳۹، ۴۹۴۰، ۴۹۴۱، ۴۹۴۲، ۴۹۴۳، ۴۹۴۴، ۴۹۴۵، ۴۹۴۶، ۴۹۴۷، ۴۹۴۸، ۴۹۴۹، ۴۹۵۰، ۴۹۵۱، ۴۹۵۲، ۴۹۵۳، ۴۹۵۴، ۴۹۵۵، ۴۹۵۶، ۴۹۵۷، ۴۹۵۸، ۴۹۵۹، ۴۹۶۰، ۴۹۶۱، ۴۹۶۲، ۴۹۶۳، ۴۹۶۴، ۴۹۶۵، ۴۹۶۶، ۴۹۶۷، ۴۹۶۸، ۴۹۶۹، ۴۹۷۰، ۴۹۷۱، ۴۹۷۲، ۴۹۷۳، ۴۹۷۴، ۴۹۷۵، ۴۹۷۶، ۴۹۷۷، ۴۹۷۸، ۴۹۷۹، ۴۹۸۰، ۴۹۸۱، ۴۹۸۲، ۴۹۸۳، ۴۹۸۴، ۴۹۸۵، ۴۹۸۶، ۴۹۸۷، ۴۹۸۸، ۴۹۸۹، ۴۹۹۰، ۴۹۹۱، ۴۹۹۲، ۴۹۹۳، ۴۹۹۴، ۴۹۹۵، ۴۹۹۶، ۴۹۹۷، ۴۹۹۸، ۴۹۹۹، ۵۰૦૦)

મગર ઉસ રહમતે આલમ કા ઘર તૌહીદ કા ઘર થા
ન આ સક્તી થી માયૂસી કે યેહ ઉમ્મીદ કા ઘર થા

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

﴿3﴾ દરવાઝે પર ખૂન

ઈસ્લામ કી અલલ એ'લાન તબ્લીગ શુરૂઅ હોતે હી ઝુલ્મો સિતમ કી જાં સોઝ આંધિયાં ચલ પડીં. આહ ! નબિયોં કે સરવર, દો² જહાં કે તાજવર, મહબૂબે રબ્બે અકબર ﷺ કે જિસ્મે મુનવ્વર પર કુફ્ફારે બદ ગોહર કભી ફૂડા કરકટ ઉછાલતે તો કભી દરવાઝાએ રહમત પર જાનવરોં કા ખૂન ડાલતે, કભી રાસ્તોં મેં કાંટે વગૈરા બિછાતે તો કભી બ-દને અન્વર પર પથ્થર બરસાતે. એક બાર તો ઉન મેં સે એક બે રહ્મ ને સજદે કી હાલત મેં ગરદન શરીફ કો નિહાયત શિદ્દત સે

ફરમાને મુસ્તફા ﷺ: جَسَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर दस भरतभा सुबह और दस भरतभा शाम दुइदे पाक पढा।
 (उसे क्रियामत के दिन मेरी शफ़ाअत मिलेगी. (अ. 1/10))

દબા દિયા, કરીબ થા કે મુબારક આંખે બાહર તશરીફ લે આતીં. કભી ઐસા ભી હુવા કે સજદે કી હાલત મેં પુશ્તે અત્હર (યા'ની મુબારક પીઠ) પર બચ્ચાદાન (યા'ની વોહ ખાલ જિસ મેં ઊંટની કા બચ્ચા લિપટા હુવા હોતા હૈ) રખ દિયા. ઈલાવા અઝીં કુફફારે જફાકાર આપ ﷺ કી શાને અ-ઝમત નિશાન મેં ગુસ્તાખાના જુમ્લે બકતે, ફખ્તિયાં કસતે. આપ ﷺ કો જાદૂગર ઔર કાહિન ભી કહતે.

(أَتَّوَاهِبُ اللَّذِيئِيَّةَ ح ١٨ ص ١١٩ وغيره مَلْخَصًا)

પયમ્બર દા'વતે ઈસ્લામ દેને કો નિકલતા થા નવીદે રાહતો આરામ દેને કો નિકલતા થા નિકલતે થે કુરૈશ ઈસ રાહ મેં કાંટે બિછાને કો વુજૂદે પાક પર સો સો તરહ કે જુલ્મ ઢાને કો ખુદા કી બાત સુન કર મજહકે¹ મેં ટાલ દેતે થે નબી કે જિસ્મે અત્હર પર નજાસત ડાલ દેતે થે તમસ્બુર² કરતા થા કોઈ, કોઈ પથ્થર ઉઠાતા થા કોઈ તૌહીદ પર હંસતા થા કોઈ મુંહ ચિડાતા થા કુરૈશી મર્દ ઉઠ કર રાહ મેં આવાઝે કસતે થે યેહ નાપાકી કે છર્ચે યાર જાનિબ સે બરસતે થે કલામેહક કો સુન કર કોઈ કહતા થા યેહ શાઈર હૈ કોઈ કહતા થા કાહિન³ હૈ કોઈ કહતા થા સાહિર⁴ હૈ

મગર વોહ મમ્બએ હિલ્મો હયા ખામોશ રહતા થા

દુઆએ ખૈર કરતા થા જફા વ જુલ્મ સહતા થા

રાહે ખુદા મેં મુસીબત ઝેલના સુન્નત હૈ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને ! હમારે

પ્યારે પ્યારે આકા, મક્કી મ-દની મુસ્તફા ﷺ ને ઈસ્લામ કી ખાતિર કૈસી કૈસી તકાલીફ ઉઠાઈ ! યેહ સબ

1 : યા'ની હંસી મઝાક 2 : યા'ની મસ્બરી 3 : જિન્નાત સે પૂછ કર બાર્તે બતાને વાલા

4 : જાદૂગર

ફરમાને મુસ્તફા સલ્મુ અલ્લાહુ અલૈય્હિ વા સલ્મુ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुःख शरीफ़ न पढ़ा उस ने जफ़ा की. (महारज़न)

કુછ ખુલ કર નેકી કી દા'વત શુરૂઅ કરને કે બા'દ હુવા. લિહાઝા જબ ભી કિસી કો નેકી કી દા'વત દેને ઓર ઈસ કે સબબ કોઈ તક્લીફ ઉઠાની પડ જાએ તો સુલ્તાને ખૈરુલ અનામ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી રાહે તબ્લીગે ઈસ્લામ મેં પેશ આને વાલી તકાલીફ વ આલામ કો યાદ કર કે અદલાહ عَزَّ وَجَلَّ का शुक्र अदा कीजिये के उस ने दीन की ખાતિર સખ્તિયાં ઝેલને વાલી સુન્નત અદા કરને કી સઆદત બખ્શી. ઈસ તરહ إِنَّ شَيْطَانَ نَاكَامٌ وَ نَا مُرَادٌ હોગા ઓર સબ્ર કરના આસાન હો જાએગા. યકીનન રાહે ખુદા મેં તક્લીફેં ઉઠાના ભી સુન્નત ઓર ઈન પર સબ્ર કરના ભી સુન્નત ઓર બા વુજૂદ સખ્ત તરીન મુશ્કિલાત કે નેકી કી દા'વત કા સિલ્સિલા જારી રખના ભી સુન્નત હૈ.

सुन्नतें आम करें दीन का हम काम करें

नेक हो जायें मुसल्मान मदीने वाले

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

﴿4﴾ शि' બે અબી તાલિબ

એ'લાને નુબુવ્વત કે સાતવે⁷ સાલ જબ કુફ્ફારે કુરૈશ ને દેખા કે ઈન કે બે પનાહ સુલ્મો સિતમ કે બા વુજૂદ મુસલ્માનોં કી તા'દાદ બઢતી ચલી જા રહી હૈ ઓર હમ્ઝા વ ઉમર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا જેસે હઝરાત ભી ઈમાન લા ચુકે હૈં. શાહે હબ્શા નજજાશી ને ભી મુસલ્માનોં કો પનાહ દે દી હૈ તો “ખસાઈસે કુબ્રા” કી રિવાયત કે મુતાબિક ઉન્હોં ને બિલ ઈત્તિફાક યેહ ફૈસલા કિયા કે (હઝરતે સચ્ચિદુના) મુહમ્મદ (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) કો (مَعَادَ اللهِ عَزَّ وَجَلَّ) અલલ એ'લાન શહીદ કર દિયા

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જો મુઝ પર રોઝે જુમુઆ દુરુદ શરીફ પઢેગા મેં ક્રિયામત કે દિન ઉસ કી શકાઅત કરૂંગા. (કૌબ્રાલ)

જાએ. જબ આપ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કે ચચા અબૂ તાલિબ કો પતા ચલા તો ઉન્હોં ને ભી બની હાશિમ વ બની મુત્તલિબ કો જમ્મ કર કે કહા કે (હઝરતે સચ્ચિદુના) મુહમ્મદ (صَلَّى اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم) કો તહફફુઝ કી ખાતિર અપને શિ'બ (યા'ની દરે, ઘાટી) મેં લે ચલો. યુનાન્થે એસા હી ક્રિયા ગયા. (خصائص كبرى ج ١ ص ٢٤٩) યેહ દર્રા મક્કએ મુકર્રમા زَادَهَا اللہُ شَرْفًا وَتَعْظِيمًا મેં વાકેઅ હૈ જો બની હાશિમ કા મૌરૂસી થા. ઓર “શિ'બે અબી તાલિબ” કહલાતા થા. (દો² પહાડોં કે દરમિયાની રાસ્તે યા વહાં કે ખુશક કિત્થે યા'ની ઝમીન કો શિ'બ કહતે હૈ)

સમાજ કત્થે તઅલ્લુક (યા'ની સોશ્યલ બાયકાટ)

જબ કુફફારે કુરૈશ કો પતા ચલા કે બની હાશિમ વ બની મુત્તલિબ ને (સિવાએ અબૂ લહબ કે) બિલા ઈમ્તિયાઝે મઝહબ, સુલ્તાને અરબ, મહબૂબે રબ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કો અપને ઝિમ્મે લે લિયા હૈ, તો ઉન્હોં ને મુહસ્સબ મેં જો કે મક્કએ મુકર્રમા زَادَهَا اللہُ شَرْفًا وَتَعْظِيمًا ઓર મિના શરીફ કે દરમિયાન વાકેઅ હૈ, આપસ મેં અહ્દ ક્રિયા કે “જબ તક “બનૂ હાશિમ” મુહમ્મદ (صَلَّى اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم) કો ઈન કે હવાલે નહીં કરેંગે કોઈ શખ્સ ઈન સે કિસી કિસ્મ કા તઅલ્લુક નહીં રખેગા. ન ઈન કે પાસ કોઈ ચીઝ ફરોપ્ત કી જાએગી ન ઈન સે રિશ્તા નાતા ક્રિયા જાએગા ઓર ન હી ઈન્હેં ખુલે બન્દોં ફિરને દિયા જાએગા.” યેહ મુઆ-હદા લિખ કર કા'બએ મુશર્રફા કે દરવાઝએ મુબા-રકા પર લટકા દિયા ગયા. કુફફારે કુરૈશ ને ઈસ પર સખ્તી સે અમલ કરતે હુએ બનૂ હાશિમ ઓર બનૂ અબ્દુલ મુત્તલિબ કા મુકમ્મલ તૌર પર “સમાજ કત્થે તઅલ્લુક” (યા'ની સોશ્યલ બાયકાટ) કર દિયા. યુનાન્થે

﴿يُرْسَلُ﴾) કરમાને મુસ્તફા صَلَّي اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : મુઝ પર દુરુદે પાક કી કસરત કરો બેશક યેહ તુમ્હારે લિયે તહારત હૈ.

યેહ દોનો² ખાનદાન ભી મુસલ્માનોં કે સાથ “શિ’બે અબી તાલિબ” મેં મહ્સૂર (યા’ની મુકય્યદ) થે.

બડી સખ્તી સે કરતે થે કુરૈશ ઈસ ઘર કી નિગરાની ન આને દેતે થે ગલ્લા ઈધર તા હદે ઈસ્કાની કોઈ ગલ્લે કા સૌદાગર અગર બાહર સે આ જાતા તોરસ્તે હી મેં જા કર બૂલહબ કમબખત બહકાતા પહાડોં કા દરા ઈક કલ્અએ મહ્સૂર થા ગોયા ખુદા વાલોં કો ફાકોં મારના મન્જૂર થા ગોયા

રસૂલુલ્લાહ લેકિન મુત્મઈન થે ઓર સાબિર થે

ખુદા જિસ હાલ મેં રખ્મે ઉસી હાલત પે શાકિર થે

ચમડે કા ટુકડા ખા લિયા

અબ સૂરતે હાલ યેહ થી કે મક્કએ મુકર્રમા મેં બાહર સે જો ભી ગલ્લા (યા’ની અનાજ) આતા કુફફારે જફાકાર ઉસે ખુદ હી ખરીદ લેતે ઓર મુસલ્માનોં તક ન પહોંચને દેતે. જબ મહ્સૂરીન (યા’ની શિ’બે અબી તાલિબ મેં મુકય્યદ રહને વાલોં) કે બચ્ચે ભૂક સે બિલ-બિલાતે તો કુફફારે ના હન્જાર ઈન કી આવાઝોં પર કહ્કહે લગાતે ઓર ખુશી મનાતે થે, ખવાતીન કા દૂધ ખુશક હો ગયા થા, મહ્સૂરીન કઈ કઈ રોઝ તક ભૂકે પડે રહતે, બા’ઝ અવકાત ભૂક સે બેતાબ હો કર દરખ્તોં કે પત્તે ઉબાલ કર ખા કર પેટ ભરતે. હઝરતે સચ્ચિદુના સા’દ ઈબ્ને અબી વક્કાસ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કા બયાન હૈ કે એક બાર રાત કો ઈન્હેં સૂખે હુએ ચમડે કા એક ટુકડા કહીં સે મિલ ગયા આપ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને ઉસે પાની સે ધોયા, આગ પર ભૂના, કૂટ કર પાની મેં ધોલા ઓર સત્તૂ કી તરહ પી કર અપને પેટ કી આગ બુઝાઈ.

(الزَّوْجُ الْأَنْفُ ٢٤ ص ١٦٦) ૯

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : तुम जहाँ भी हो मुज पर दुर्रद पढो क तुम्हारा दुर्रद मुज तक पहुँचता है. (طبرانی)

વોહ ભૂકી બચ્ચિયોં કા રૂઠ કર ફિલફોર મન જાના પુદા કા નામ સુન કર સપ્ર કી તસ્વીર બન જાના તડપના ભૂક સે કુછ રોઝ આખિર જાન ખો દેના વોહ માઓં કા ફલક કો દેખ કર ચુપચાપ રો દેના રિઝા વ સપ્ર સે દિન કટ ગએ ઈન નેક બખ્તોં કે કે ખાને કે લિયે મિલતે રહે પત્તે દરખ્તોં કે

ગુઝારે તીન સાલ ઈસ રંગ સે ઈમાન વાલોં ને

દિખા દી શાને ઈસ્તિકલાલ અપની આન વાલોં ને

દીમક કા કમાલ

જબ તીન³ સાલ ઈસી હાલ મેં ગુઝર ગએ તો અલ્લાહ عَزَّ وَجَلَّ ને અપને હબીબે પાક صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કો ખબર દી કે ઉસ મુઆ-હદે કી તહરીર દીમક ઈસ તરહ ચાટ ગઈ હૈ કે અલ્લાહ عَزَّ وَجَلَّ કે નામ કે સિવા ઈસ મેં કુછ બાકી નહીં રહા. આપ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ને યેહ ખબર અબૂ તાલિબ કો દી, ઉસ ને જા કર કુફરે કુરૈશ સે કહા : “ઐ ગુરૌહે કુરૈશ ! મેરે ભતીજે ને મુઝ કો ઈસ તરહ કી ખબર દી હૈ તુમ અપના લિખા હુવા મુઆ-હદા લાઓ, અગર યેહ ખબર સહીહ નિકલી તો તુમ કત્એ રેહ્મ (યા’ની રિશ્તેદારી તોડને) સે બાઝ આઓ ઓર અગર ગલત નિકલી તો મેં અપને ભતીજે કો તુમ્હારે હવાલે કર દૂંગા.” વોહ ઈસ પર રાઝી હો ગએ. જબ “મુઆ-હદા” દેખા ગયા તો વૈસા હી થા જૈસા કે ખબર દી ગઈ થી. કુછ કીલો કાલ (યા’ની બહસો મુબા-હસે) કે બા’દ પાંચ⁵ અશખાસ (હિશામ બિન અમ્ર, ઝુહૈર બિન અબી ઉમય્યા મખ્ઝૂમી, મુલ્દમ બિન અદી, અબુલ બખ્તરી ઓર ઝમ્મા બિન અસ્વદ) ઈસ મુઆ-હદે કો ચાક કરને (યા’ની ફાડ ડાલને) પર મુત્તફિક હો ગએ ઓર આખિર કાર અબુલ બખ્તરી ને

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : جِس نے مُؤْمِن پَر دَس مَرतभा दुरेद पाक पढा अब्बलاد اُسی पَر सो रडमतें नाजिल इरमाता है. (طرائف)

લે કર ફાડ ડાલા. મગર અફસોસ ! કુફરારે બદ અત્વાર બજાએ નાદિમ વ શર્મ-સાર હોને કે મઝીદ દર પૈ આઝાર હો ગએ. (સીરતે રસૂલે અ-રબી, સ. 63) “સુબુલુલ હુદા” મેં હૈ : ઈન પાંચ⁵ મેં સે હઝરતે સય્યિદુના હિશામ રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ और હઝરતે સય્યિદુના ઝુહૈર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કો ઈસ્લામ કબૂલ કરને કી સઆદત નસીબ હુઈ. (سُبُلُ الْهُدَى ج ٢ ص ٤١٤)

હક કી રાહ મેં પથ્થર ખાએ ખૂં મેં નહાએ તાઈફ મેં
દીન કા કિતની મેહનત સે કામ આપ ને એ સુલ્તાન કિયા

(વસાઈલે બખ્શિશ, સ. 388)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

﴿5﴾ તાઈફ કા લરઝા ખેઝ સફર

અબ સફરે મદીના કે દૌરાન મક્કએ મુકર્રમા رَادَهَا اللهُ شَرْفًا وَتَعْظِيمًا

સે ઈસ્લામી ભાઈયોં કી તરફ ઈરસાલ કર્દા એક “ઈજતિમાઈ મક્તૂબ” મેં સે તાઈફ કી રિક્કત અંગેઝ દાસ્તાન હરબે ઝરૂરત તરમીમ કે સાથ પેશ કી જાતી હૈ, ઈસે અશકબાર આંખોં સે પઢિયે : એ’લાને નુબુવ્વત કે બા’દ નવ સાલ તક હમારે મીઠે મીઠે, પ્યારે પ્યારે આકા, મદીને વાલે મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم મક્કએ મુકર્રમા رَادَهَا اللهُ شَرْفًا وَتَعْظِيمًا કે અન્દર લોગોં મેં ઈસ્લામ કી તબ્લીગ ફરમાતે રહે, મગર બહુત થોડે અફરાદ ને આપ صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી નેકી કી દા’વત કબૂલ કી. કુફરારે બદ અત્વાર કી તરફ સે મુખા-લફત કા ઝોર રોઝ બરોઝ બઢતા જા રહા થા. શાહે ખૈરુલ નામ صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم और सहाबओ किराम الرضوان को कुर्फार बेहद

ફરમાને મુસ્તફા ﷺ : जिस के पास मेरा ऊँट हो और वोड़ मुऊ पर दुइद शरीक न पढे तो वोड़ लोगों में से कन्जूस तरीन शम्स है. (अब्दुल)

સતાતે ઓર તરહ તરહ સે મઝાક ઉડાતે થે. હાં કાફિર હોને કે બા વુજૂદ બા'ઝ લોગ ઐસે ભી થે જો આપ ﷺ સે હમદદર્દી રખતે થે, ઈન્હીં મેં સે આપ ﷺ કા ચયા અબૂ તાલિબ ભી થા, ઈસ કા કુફર પર કાફી રો'બો દબદબા થા. દસવેં સાલ ઈસ કા ઈન્તિકાલ હો ગયા. અબ કાફિરોં કે હૌસલે એક દમ બુલન્દ હો ગએ ઓર ઉન કી તરફ સે જુલ્મો સિતમ કી આંધિયોં ને ખૂબ ઝોર પકડ લિયા. યુનાન્થે રહમતે આલમ ﷺ ને તાઈફ કા કસ્દ (યા'ની ઈરાદા) ફરમાયા તા કે વહાં જા કર લોગોં કો ઈસ્લામ કી દા'વત ઈનાયત ફરમાએ, તાઈફ પહોંચ કર બાનિયે ઈસ્લામ, શહન્શાહે ખૈરુલ અનામ, મહબૂબે રબ્બુસ્સલામ ﷺ ને પહલે પહલ બનૂ સકીફ કે તીન^૩ સરદારોં કો ઈસ્લામ કા પૈગામ પહોંચાયા. વોહ હાદી જો ન હો સકતા થા ગૈરલલાહ સે ખાઈફ ચલા ઈક રોઝ મક્કે સે નિકલ કર જાનિબે તાઈફ દિયા પૈગામે હક તાઈફ મેં, તાઈફ કે રઈસોં કો દિખાઈ જિન્સે રૂહાની કમીનોં કો ખસીસોં^૧ કો

કલમ કાંપતા હૈ !

અફસોસ ! ઉન નાદાનોં ને હુસ્ને અપ્લાક કે પૈકર, નબિયોં કે તાજવર, મહબૂબે રબ્બે અકબર ﷺ કી નેકી કી દા'વત સુન કર બજાએ સરે તસ્લીમ ખમ કરને કે ઈન્તિહાઈ સરકશી કા મુઝા-હરા કિયા ઓર તરહ તરહ સે બકવાસ કરને લગે. આહ ! ઉન બદ અપ્લાક સરદારોં ને ઐસે ઐસે ગુસ્તાખાના જુમ્લે બકે કે ઈન કો કલમ બન્દ કરને સે સગે મદીના^૨ કા કલમ કાંપતા હૈ,

1 : ખસીસ કી જમ્અ, ના લાઈકોં 2 : યા'ની ઈસે મુઆફી દી જાએ, અલ્લાહ ﷻ ઈસ કો મુઆફ ફરમાએ.

करमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : उस शप्स की नाक पाक आवूद हो जिस के पास मेरा ठिंक हो और वोह मुज पर दुइरे पाक न पड़े. (माम)

मेरे ध्यारे आका भीठे भीठे मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने अब भी हिम्मत न हारी, दूसरे लोगों की तरफ़ तशरीफ़ लाये और उन्हें द्वा'वते इस्लाम पेश की. आह ! सद आह ! सरवरे कायेनात, शाहे मौजूदात, महबूबे रब्बुल अर्दि वरसमावात صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के पैगामे नजात को सुनने के लिये कोई तय्यार ही न था, अफ़सोस ! वोह लोग अपने अजीम मोहसिन को दुश्मन समझ बैठे और तरह तरह से दिल आज़ारियों पर उतर आये. उन की बक्वास को सफ़हये किरतास (या'नी कागज़ के सफ़हे) पर तहरीर करने की सगे मदीना غ्फ़े में ताब कहां ! उन बे रहमों ने सिर्फ़ उल झूल बकने ही पर इक्तिफ़ा न किया बल्के औबाश लडकों को भी पीछे लगा दिया. येह अल्फ़ाज़ तहरीर करते हुये दिल गम में डूबा जा रहा है, आंभें पुरनम हुँ जा रही हैं, आह ! वोह ज़ालिम नौ जवान, मेरी आंभों की ठन्डक और दिल के यैन, रहमते दारैन, ताजदारे ह-रमैन, सरवरे कौनैन, नानाये ह-सनैन صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآलِهِ وَسَلَّمَ की जान को आ गये और तालियां बजाते, तरह तरह से इफ़्तियां कसते पीछा करने लगे, यकायक इन ज़ालिमों ने पथर उठा लिये और टेपते ही टेपते..... आह ! आह ! सद हज़ार आह ! मेरे आका..... मेरे भीठे भीठे आका..... मेरे दिल के सुल्तान आका..... रहमते आ-लमियान आका صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآलِهِ وَسَلَّمَ के जिस्मे मुबारक पर पथराव शुइअ कर दिया, हाये काश ! सगे मदीना غ्फ़े उस वक्त पैदा हो कर इमान ला चुका होता..... काश ! दीवाना वार..... परवाना वार..... मस्ताना वार..... वोह सारे पथर अपने जिस्म पर ज़ेलता.

मगर करें क्या नसीब में तो येह ना मुराही के दिन लिखे थे

કરમાને મુસ્તફા સલ્મુ અલ્લાહુ અલેહી વાલેહી વસલ્મુ : જિસ્ ને મુઝ પર રોઝે જુમુઆ દો સો બાર દુરૂદે પાક પઢા ઉસ કે દો સો સાલ
કે ગુનાહ મુઆફ હોંગે. (કુઆલ)

ન જાને ચશમે ફલક ને યેહ ખૂની મન્ઝર કેસે દેખા હોગા ? આહ ! જિસ્મે નાઝનીન પથ્થરોં સે ઝખ્મી હો ગયા ઓર ઈસ કદર ખૂન શરીફ બહા કે ના'લૈને મુબારક ખૂન સે ભર ગઈ. જબ આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ બે કરાર હો કર બૈઠ જાતે તો કુફફારે જફાકાર બાઝૂ થામ કર ઉઠા દેતે. જબ ફિર ચલને લગતે તો દોબારા પથ્થર બરસાતે ઓર સાથ સાથ હંસતે જાતે.

બદે અમ્બોહ¹ દર અમ્બોહ પથ્થર લે કે દીવાને લગે મીંહ પથ્થરોં કા રહમતે આલમ પે બરસાને વોહ અબ્રે લુફ જિસ કે સાએ કો ગુલશન તરસતે થે યહાં તાઈફ મેં ઉસ કે જિસ્મ પર પથ્થર બરસતે થે વોહ બાઝૂ જો ગરીબોં કો સહારા દેતે રહતે થે પયા પે આને વાલે પથ્થરોં કી ચોટ સહતે થે વોહ સીના જિસ કે અન્દર નૂરે હક મસ્તૂર² રહતા થા વોહી અબ શક હુવા જાતા થા ઈસ સે ખૂન બહતા થા જગહ દેતે થે જિન કો હામિલાને અર્શ³ આંખોં પર વોહ ના'લૈને મુબારક હાએ ખૂં સે ભર ગઈ યકસર હુઝૂર ઈસ જોર⁴ સે જબ ચૂર હો કર બૈઠ જાતે થે શકી⁵ આતે થે બાઝૂ થામ કર ઊપર ઉઠાતે થે

પહાડોં કા ફિરિશ્તા

હઝરતે સચ્ચિદુના જિબ્રાઈલ અમીન الصَّلَاةُ وَالسَّلَام عَلَيْهِ لકુલ જિબાલ (યા'ની પહાડોં પર મુઅકિકલ ફિરિશ્તે) કો લે કર તાજદારે રિસાલત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી ખિદમતે સરાપા અ-ઝમત મેં હાઝિર હુએ. મ-લકુલ જિબાલ ને આપ કી બારગાહ મેં સલામ અર્ઝ કર કે દર-ખવાસ્ત કી : અગર આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હુકમ ફરમાએ તો દોનોં પહાડોં કો ઈન કુફફાર પર ઉલટ દેતા

1 : યા'ની હુજૂમ 2 : પોશીદા, છુપા હુવા 3 : અર્શ ઉઠાને વાલે ફિરિશ્તે 4 : ઝુલ્મ

5 : બદ બખ્ત.

કરમાને मुस्तफا صلی اللہ تعالیٰ علیہ و آلہ وسلم : मुअ पर दुइद शरीक पढो अद्लाह एउउं तुम पर रडमत भेजेगा. (अहमद)

હું. યેહ સુન કર નબિય્યે રહમત, શફીએ ઉમ્મત, માલિકે કૌસરો જન્નત, સરાપા જૂદો સખાવત, કાસિમે ને'મત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને જવાબ દિયા : “મેં અલ્લાહ عَزَّوَجَلَّ કી ઝાતે પાક સે પુર ઉમ્મીદ હું કે અગર યેહ લોગ ઈમાન નહીં લાએ તો ઈન કી ઔલાદ મેં ઐસે લોગ પૈદા હોંગે જો અલ્લાહ عَزَّوَجَلَّ કી ઈબાદત કરેંગે.”

(بخاری ج ۲ ص ۳۸۲ حدیث ۳۲۳۱) —

અગર યેહ લોગ આજ ઈસ્લામ પર ઈમાં નહીં લાતે ખુદાએ પાક કે દામાને વહુદત મેં નહીં આતે મગર નસલેં ઝરૂર ઈન કી ઈસે પહયાન જાએંગી દરે તૌહીદ પર ઈક રોઝ આ કર સર ઝુકાએંગી

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

કોઈ ડાંટ કર તો દિખાએ !

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હમનેં કોઈ ઝરા સા ડાંટ દે બલકે ઈસ્લાહ કી ખાત હી કહ દે તો બસા અવકાત હમ આપે સે બાહર હો જાતે હેં, અગર કોઈ ગાલી દે દે યા થપ્પડ વગૈરા માર દે તબ તો મુકમ્મલ બલકે કઈ ગુના ઝિયાદા ઈન્તિકામ લે લેને કે બા વુજૂદ ભી શાયદ હમારા ગુસ્સા ઠન્ડા ન હો. મગર કુરબાન જાઈયે ! ખા-તમુલ મુર-સલીન, રહ્મતુલ્લિલ આ-લમીન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર કે ઈતના ઈતના સતાએ જાને કે બા વુજૂદ ભી આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કો અપની ઝાત કે લિયે ગુસ્સા નહીં આતા ઔર ન હી અપને દુશ્મન કી બરબાદી વ હલાકત કી આરઝૂ હૈ, અગર કોઈ આરઝૂ હૈ તો ફકત યેહી કે ઈસ્લામ કા બોલબાલા હો, હર જાનિબ ખુદા عَزَّوَجَلَّ કે દીન કા ઉજાલા હો ઔર લોગ એક અલ્લાહ عَزَّوَجَلَّ કી બારગાહ મેં ઝુક જાએ.

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર કસરત સે દુરુદ પાક પઢો બેશક તુમહારા મુઝ પર દુરુદ પાક પઢના તુમહારે ગુનાહોં કે લિયે મગ્ફિરત હૈ. (મુસ્નિદ)

આસાનિયોં કે બા વુજૂદ સુસ્તી

ઐ ઈશકે રસૂલ કા દમ ભરને વાલે ! મદીના મદીના કરને વાલે આશિકાને રસૂલ ! ક્યા ઈસી કા નામ ઈશકે રસૂલ હૈ કે સચ્ચિદુલ મુબલ્લિગીન, રહ્મતુલ્લિલ આ-લમીન صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم તો કાંટોં પર ચલ કર ભી તબ્લીગે દીન કરેં ઔર હમ ઠન્ડી હવા ફેંકને વાલે પંખોં કે સાએ મેં બલ્કે A.C. કી ઠન્ડક મેં કાલીનોં પર બૈઠ કર ભી નેકી કી દા'વત ન દે પાએં ! અહલાહ عَزَّوَجَلَّ કે પ્યારે હબીબ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ફાકોં કે સબબ અપને મુબારક પેટ પર પથ્થર બાંધ કર ભી ઈસ્લામ કી તબ્લીગ ફરમાએં ઔર હમ ડટ કર ઔર વોહ ભી ઉમ્દા સે ઉમ્દા ને'મતેં ખાને કે બા વુજૂદ ભી દીન કે લિયે કુછ ન કર પાએં ! ક્યા મહબ્બતે રસૂલ ઈસી કા નામ હૈ કે મહબૂબે રબ્બે અકબર, મક્કે મદીને કે તાજવર, સબ્રો રિઝા કે પૈકર صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم અપને બ-દને અત્હર પર પથ્થર ખા કર ભી ઈસ્લામ કી તબ્લીગ કા ફરીઝા બજા લાએં ઔર હમ પર લોગ ફૂલ નિછાવર કરેં ફિર ભી હમ ઈસ અઝીમ મ-દની કામ સે જી ચુરાએં.

હાયે ! મુસલ્માનોં કા બિગડા હુવા ફિરદાર !

ઐ પ્યારે મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم કી દીવાનગી મેં ઝૂમને વાલે આશિકાને રસૂલ ! મુસલ્માનોં કી ખસ્તા હાલી આપ કે સામને હૈ, ક્યા બે અ-મલી કે સૈલાબ ઔર મસ્જિદોં કી વીરાની દેખ કર આપ કા દિલ નહીં જલતા ? આહ ! મગરિબી ફેશન કી ચલગાર, ફિરંગી તહઝીબ કી તૂમાર, બે હયાઈયોં સે ભરપૂર પ્રોગ્રામ દેખને કે લિયે ઘર ઘર રખે હુએ ટીવી ઔર વીસીઆર,

કરમાને મુસ્તફા સલ્મુલ્લાહી વ્હી વ્હી : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢતા હે અલ્લાહ ઈસ કે લિયે એક કીરાત
અજ લખતા હે ઓર કીરાત ઉલુદ પહાડ જિતના હે. (મુબારક)

કદમ કદમ પર ગુનાહોં કી ભરમાર, હાએ ! મુસલમાનોં કા બિગડા
હુવા કિરદાર ! યેહ સબ બાતેં મુસલમાનોં કી ખૈર ખ્વાહી ઓર
આખિરત કી બેહતરી કે તલબ ગાર મુસલમાન કે લિયે બેહદ કબોં
ઈઝતિરાબ કા બાઈસ હેં ઓર વોહ ઈસ્લાહે મુસ્લિમીન કે લિયે બે
કરાર હો જાતા હે, ઐ કાશ ! હમેં બે અમલ મુસલમાનોં કે સુધાર કી
કોશિશ કા અઝીમ જઝબા નસીબ હો જાએ ! કાશ ! હમ અપને
અઝીમ મ-દની મક્સદ મેં કામ્યાબ હો જાએ. આઈયે ! લગે હાથોં
અપના મ-દની મક્સદ મિલ કર દોહરાએ લેતે હેં : મુઝે અપની ઓર
સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હે. **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ**

દો દર્દ સુન્નતોં કા પએ શાહે કરબલા

ઉમ્મત કે દિલ સે લઝઝતે ફેશન નિકાલ દો

(વસાઈલે બખ્શિશ, સ. 290)

નેકી કી દા'વત કી ફઝીલત વ અ-ઝમત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હમેં ખૂબ ખૂબ નેકી કી દા'વત
કી ધૂમેં મયાની ચાહિએ, નેકી કી દા'વત કી દુન્યવી વ ઉખરવી બ-ર-કતોં
કે ક્યા કહને ! અલ્લાહ ઈસને હઝરતે સચ્ચિદુના મૂસા કલીમુલ્લાહ
કી તરફ વહ્ય ફરમાઈ કે જિસ ને ભલાઈ કા
હુકમ દિયા ઓર બુરાઈ સે મન્અ ક્રિયા ઓર લોગોં કો મેરી ઈતાઅત
(યા'ની ફરમાં બરદારી) કી તરફ બુલાયા, કિયામત કે દિન મેરે અર્શ
કે સાએ મેં હોગા.

(حَدِيثُ الْأَوْلِيَاءِ ج ٦ ص ٣٦ رقم ٧٧١٦)

બા વુજૂદે ફુદરત ગુનાહ સે ન રોકને વાલે કે લિયે વર્ષદ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! યાદ રખિયે ! જો કૌમ ફુદરત કે
બા વુજૂદ ગુનાહ કરને વાલે કો ઈસ સે રોકતી નહીં, અન્દેશા હે કે

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَاللَّهُ وَسَلَّمَ : जिस ने क़िताब में मुज़ पर दुड़टे पाक लिખा तो ज़ब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये ईस्तिस्कार करते रहेंगे. (उं.)

વોહ ન રોકને વાલી કૌમ મરને સે પહલે દુન્યા હી મેં અઝાબ મેં ગિરિફતાર હો જાએ. યુનાન્યે ફરમાને મુસ્તફા ﷺ : अगर किसी कौम में कोई शप्स गुनाह का मुर-तकिब हो और कौम के लोग भा वुजूदे कुदरत उसे गुनाह से न रोकें तो अल्लाह عزوجل उन के मरने से पहले उन पर अपना अज़ाब नाज़िल इरमाओगा.

(ابوداؤد ج ٤ ص ١٦٤ حدیث ٤٣٣٩)

40 હઝાર અચ્છે ભી હલાક કરૂંગા ક્યૂંકે.....

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બે નમાઝિયોં, ગાલિયાં બકને વાલોં, ફિલ્મોં, ડિરામોં, ગાનોં બાજોં, ગીબતોં ઓર યુગ્લિયોં વગૈરા ગુનાહોં સે બાઝ ન આને વાલોં સે દોસ્તિયાં ગાંઠના, ઈન કી હૌસલા અફઝાઈ કા બાઈસ બનના, ઈન કે સાથ ઉઠના બૈઠના, ખાના પીના વગૈરા દુન્યા વ આખિરત કે લિયે સખ્ત તબાહ કુન હૈ. ફુસ્સાક વ ફુજજાર કી સોહબત ઈખ્તિયાર કરને વાલોં કી મઝમ્મત કરતે હુએ મેરે આકા આ'લા હઝરત ઈમામે અહલે સુન્નત મુજદિદે દીનો મિલ્લત મૌલાના શાહ ઈમામ અહમદ રઝા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن ફતાવા ર-ઝવિયા જિલ્દ 22 સફહા 211 તા 212 પર નકલ કરતે હેં :
અલ્લાહ عزوجل ઈશાદે ફરમાતા હૈ :

وَأَمَّا يُسَيِّئُكَ الشَّيْطٰنُ فَلَا تَر-જ-મએ કન્જુલ ઈમાન : ઓર જો કહી
تَقْعُدُ بَعْدَ الذِّكْرِى مَعَ الْقَوْمِ તુજે શૈતાન ભુલાવે તો યાદ આએ પર
الظَّالِمِينَ ۞ (٧٧-الانعام ١٦٨)

(ભયાન કદા આયતે મુબા-રકા મેં “ઝાલિમીન” સે મુરાદ કૌન લોગ હેં, ઈસ કી વઝાહત કરતે હુએ ફરમાતે હેં) તફ્સીરે અહમદી મેં હૈ :

ફરમાને મુસ્તફા ﷺ : جيس نے મુઝ પર એક બાર દુરુદ પાક પઢા અલ્લાહ ઊંસ પર દસ રહમતે ભેજતા હૈ. (مسلم)

ઝાલિમ લોગ બદ મઝહબ ઓર ફાસિક ઓર કાફિર હૈ, ઈન સબ કે પાસ બૈઠના મન્અ હૈ. (الفتاوى المحررة ૩૪૪) મરવી હુવા અલ્લાહ ઊંસ ને (હઝરતે સય્યિદુના) યૂશઅ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام કો વહ્ય ભેજી : मैं तेरी बस्ती से याकीस हज़ार अच्छे और साठ हज़ार बुरे लोग हलाक करूंगा. अर्ज की : एलाही ! बुरे तो बुरे हैं अच्छे क्यूं हलाक होंगे ? फरमाया : इस लिये के जिन पर मेरा ग़ज़ब था उन्हों ने उन पर ग़ज़ब न किया और उन के साथ जाने पीने में शरीक रहे.

(الامر بالمعروف والنهي عن المنكر مع موسوعة ابن أبي الدنيا ج ٢ ص ٢١٣ رقم ٧١)

નેકી કી દા'વત કે લિયે સફર કરના સુન્નત હૈ

ઐ આશિકાને રસૂલ ! બસ ગુનાહોં કે ખિલાફ એ'લાને જંગ કર દીજિયે, ખુદ કો ગુનાહોં સે બયાને કે સાથ દૂસરોં કો બયાને પર કમર બાંધ લીજિયે, નેકી કી દા'વત દેના, ઈસ કે લિયે ઘર સે નિકલના, ઈસ કી ખાતિર સફર ઈજ્તિયાર કરના, ઈસ રાહ મેં આને વાલી તકાલીફ કો બરદાશત કરના યકીનન હમારે મીઠે મીઠે આકા મક્કી મ-દની મુસ્તફા ﷺ કી પ્યારી પ્યારી સુન્નતેં હૈ. ઐ કાશ ! હમ પર ભી કરમ હો જાએ ઓર હમ ભી ઈન અઝીમ સુન્નતોં પર અમલ કરને વાલે બન જાએં ઓર નેકી કી દા'વત કી ખાતિર ઘર સે નિકલના, સુન્નતોં કી તરબિય્યત કે લિયે આશિકાને રસૂલ કે મ-દની કાફિલોં મેં સફર કરના ઓર ઈસ કી તમામ તર સખ્તિયોં પર સબ્ર કરના સીખ લેં. ઐ આશિકાને રસૂલ કહલાને વાલો ! દુન્યા કે કામ ધન્દોં કે લિયે તો બરસોં ઘર સે દૂર

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જો શપ્સ મુઝ પર દુરૂદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (طبرانی)

રહને કે લિયે તય્યાર હો જાતે હો, કયા અલ્લાહ عَزَّوَجَلَّ કે દીન કી સર બુલન્દી કે લિયે મ-દની કાફિલે મેં સુન્નતોં ભરે સફર કી ચન્દ રોઝ કે લિયે ભી કુરબાની નહીં દોગે ?

સુન્નત હૈ સફર દીન કી તબ્લીગ કી ખાતિર

મિલતા હૈ હમેં દર્સ યેહ અસ્ફારે' નબી સે

(વસાઈલે બખ્શિશ, સ. 203) (1 : સફર કી જમ્અ)

صَلُّوْا عَلَی الْحَبِیْب ! صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ مُحَمَّدٌ

ઇસ્લામ કે ફઝાઇલ મેં ચાર ફરામીને મુસ્તફા

ઇસ્લામ કા દર્દ દિલ મેં રખને વાલે હર મુસલમાન સે મેરી ગમગીન ઈલ્તિજા હૈ કે તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે દુન્યા મેં જહાં કહીં “મ-દની કાફિલે” નઝર આએં ઈન કે સાથ કુછ ન કુછ વક્ત ઝરૂર ગુઝારિયે ઔર અલ્લાહ عَزَّوَجَلَّ તૌફીક દે તો ઈન કે સાથ સુન્નતોં ભરા સફર ઈખ્તિયાર કર કે અજૂરો સવાબ કે હકદાર બનિયે. મ-દની કાફિલે મેં સફર ઈલ્મે દીન હાસિલ કરને કા બેહતરીન ઝરીઆ હૈ ઔર ઈલ્મે દીન કે ફઝાઇલ કે ભી કયા કહને ! “દા'વતે ઈસ્લામી” કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 743 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “જન્નત મેં લે જાને વાલે આ'માલ” સફહા 38 તા 40 સે ચાર ફરામીને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم મુલા-હઝા હોં : ﴿1﴾ જો શપ્સ ઈલ્મ કી તલબ મેં ઘર સે નિકલતા હૈ ફિરિશ્તે ઉસ કે ઈસ અમલ સે ખુશ હો કર ઉસ કે લિયે અપને પર બિછા દેતે હૈં. (طبرانی کبیر ج ۸ ص ۴۰ حدیث ۷۴۴۷)

ફરમાને મુસ્તફા ﷺ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुश्मते पाक न पढा तलक की वोह बढ भप्त हो गया. (उंन)

﴿2﴾ જો કોઈ અલ્લાહ وَعَزَّ وَجَلَّ કે ફરાઈજ સે મુ-તઅલ્લિક એક યા દો યા તીન યા ચાર યા પાંચ કલિમાત સીખે ઓર ઉસે અચ્છી તરહ યાદ કર લે ઓર ફિર લોગોં કો સિખાએ તો વોહ જન્નત મેં દાખિલ હોગા.

﴿3﴾ જો સુબ્હ કો મસ્જિદ કી તરફ ભલાઈ સીખને યા સિખાને કે ઈરાદે સે ચલેગા ઉસે કામિલ હજ કરને વાલે કા સવાબ મિલેગા. (طَبْرَانِي كَبِير ج ٨ ص ١٤ حديث ٧٤٧٣)

﴿4﴾ જો બન્દા ઈલ્મ કી જુસ્ત-જૂ મેં જૂતે, મોઝે યા કપડે પહનતા હૈ તો અપને ઘર કી ચૌખટ (યા'ની દરવાઝે) સે નિકલતે હી ઉસ કે ગુનાહ મુઆફ કર દિયે જાતે હૈં. (طَبْرَانِي أَوْسَط ج ٤ ص ٢٠٤ حديث ٥٧٢٢)

અમીરે કાફિલા કે હુસ્ને અપ્લાક ને મુઝે મ-દની કાફિલે કા મુસાફિર બના દિયા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હુસૂલે ઈલ્મ કા એક બેહતરીન ઝરીઆ દા'વતે ઈસ્લામી કે મ-દની કાફિલે ભી હૈં, ઉમ્ર ભર મેં યક મુશ્ત 12 માહ, હર બારહ માહ મેં 30 દિન ઓર હર તીસ દિન મેં 3 દિન આશિકાને રસૂલ કે સાથ મ-દની કાફિલોં મેં સુન્નતોં ભરા સફર કીજિયે. મ-દની કાફિલે કી બ-ર-કતોં કો સમઝને કે લિયે એક મ-દની બહાર મુલા-હઝા ફરમાઈયે, યુનાન્ચે મર્કઝુલ ઓલિયા (લાહોર) કે એક ઈસ્લામી ભાઈ કા બયાન કુછ યૂં હૈ કે મેરી ઉમ્રે અઝીઝ કે 25 બરસ ગુઝર ચુકે થે મગર મેં ઈલ્મે દીન સે ઈસ કદર કોરા થા કે મુઝે નમાઝ વ રોઝે કે બુન્યાદી અહકામ તક મા'લૂમ ન થે. એક દિન મસ્જિદ મેં નમાઝ કે લિયે હાઝિર હુવા તો એક ઈસ્લામી ભાઈ ને બડે તપાક સે આગે બઢ કર મુઝ સે મુલાકાત કી, ઈસી દૌરાન મ-દની કાફિલે મેં સફર કી દા'વત ભી દી.

ફરમાને મુસ્તફા ﷺ : جس نے مومنوں پر ایک بار دھڑکے پاક پڑا اعداوں کے لئے اس پر دس
 رહमतें बेजता है. (مسلم)

દા'વતે ઈસ્લામી કે “મ-દની માહોલ” સે ના આશનાઈ કે બાઈસ મેં ને ઈન્કાર કર દિયા મગર હમારે મહલ્લે કી મસ્જિદ કે ઈમામ સાહિબ ને મુઝ પર ઈન્ફિરાદી કોશિશ ફરમાઈ ઔર મેરી ખૂબ હિમ્મત બંધાઈ યહાં તક કે ઉન્હોં ને મુઝે મ-દની કાફિલે મેં સફર કે લિયે આમાદા કર લિયા. મેં સફર કી નિચ્ચત સે હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં હાઝિર હો ગયા, ઈજતિમાઅ કે બા'દ સુબ્હ મ-દની કાફિલે ને સફર કરના થા, મેં દુન્યા કી મહબ્બત કા મારા ઈતની દેર મસ્જિદ મેં રહને સે ઉક્તા સા ગયા થા ઔર “મ-દની કાફિલે” મેં મઝીદ ૩ દિન મસ્જિદ મેં રહને કે તસવ્વુર સે ઘબરા રહા થા, મેં ને યહાં સે ફિરાર હો જાને કી નિચ્ચત ભી કર લી થી કે ઈતને મેં મેરે અમીરે કાફિલા ઢૂંડતે હુએ મુઝ તક આ પહોંચે, શૈતાન ને મુઝે ઉક્સાયા કે “મિયાં અબ તો ફંસે ! યેહ મૌલવી તુમ્હેં નહીં છોડેગા,” મેં ને ભી દિલ મેં કહા : દેખતા હૂં મુઝે યેહ કેસે કાફિલે મેં લે જાતા હૈ ! લિહાઝા શૈતાન કે બહકાવે મેં આ કર મેં ને અપને મોહસિન અમીરે કાફિલા કો ગુસ્સે મેં ઝાડ દિયા કે “મિયાં જાઓ ! મેં આપ કો નહીં જાનતા મુઝે કિસી મ-દની કાફિલે મેં નહીં જાના, બસ મુઝે તંગ ન કરો ઘર જાને દો.” યકીન માનિયે ! મેરી હૈરત કી ઉસ વક્ત ઈન્તિહા ન રહી જબ અપની જલી કટી સુનાને કે બા'દ અમીરે કાફિલા કે લબોં પર મુસ્કુરાહટ ખેલતી દેખી ! ઉન્હોં ને મુઝ પર ગુસ્સે કે ઝરીએ જવાબી કારવાઈ કરને કે બજાએ મુસ્કુરા મુસ્કુરા કર નિહાયત શફકત ઔર નરમી સે મ-દની કાફિલે મેં સફર કે લિયે મુઝે સમઝાના શુરૂઅ કર દિયા ઔર ઈસ કે લિયે મેરી મિન્નત વ સમાજત કરને લગે, ઉન કે આ'લા અખ્લાક ને મુઝે મ-દની

ફરમાને મુસ્તકા صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم : જો શપ્સ મુઝ પર દુરૂદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (ટી.કે.)

કાફિલે મેં સફર પર રાઝી કર હી લિયા ઓર મેં આશિકાને રસૂલ કે હમરાહ મ-દની કાફિલે મેં સુન્નતોં ભરે સફર પર રવાના હો ગયા, પહલે હી દિન જબ મ-દની કાફિલે વાલોં ને સીખને સિખાને કે મ-દની હલકે લગાએ તો મુઝે દિલ હી દિલ મેં બેહદ નદામત હોને લગી કે સદ કરોડ અફસોસ ! 25 સાલ કી ઉમ્મર હો ગઈ મગર અભી તક દીન કે બુન્યાદી અહકામ ભી મુઝે નહીં મા'લૂમ ! اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ ! આશિકાને રસૂલ કી સોહબત મેં 3 દિન ગુઝારને કે બા'દ મેં બહુત સા ઈલ્મે દીન મ-સલન વુઝૂ, ગુસ્લ ઓર નમાઝ કે કઈ અહકામ સીખ કર ઓર નેકી કી દા'વત કી ધૂમેં મયાને કા અઝીમ જઝબા લે કર ઈસ હાલ મેં ઘર પલટા કે મેરે સર પર મ-દની કાફિલે કી યાદ દિલાતા સબ્ઝ સબ્ઝ ઈમામે શરીફ કા તાજ જગમગા રહા થા.

અચ્છી સોહબત મિલે, ખૂબ બ-ર-કત મિલે યલ પડો યલ પડેં કાફિલે મેં યલો લૂટ લેં રહમતેં, ખૂબ લેં બ-ર-કતેં ખ્વાબ અચ્છે દિખેં, કાફિલે મેં યલો

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّد

ઇસ્તિકામત બહુત ઝરૂરી હે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હુનર કોઈ સા ભી હો જબ તક ઉસે ઈસ્તિકામત સે ન સીખા જાએ મહારત હાસિલ હોના દુશ્વાર હૈ, યેહી મુઆ-મલા ઈલ્મે દીન કા હૈ, નફ્સ લાખ સુસ્તી દિલાએ, શૈતાન ગફ્લત કી નીંદ સુલાને કે લિયે ખ્વાહ કિતની હી લોરિયાં સુનાએ આપ હોશિયાર વ બેદાર રહિયે, દા'વતે ઈસ્લામી કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : جيس کے پاس मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुइदुइ पाक न पढा तहकीक
वोह बह बप्त हो गया. (उंठ)

ભરા સફર કરતે કરાતે રહિયે ઔર ઇલ્મે દીન સીખતે સિખાતે રહિયે, **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** કામ્યાબી ઝરૂર આપ કે કદમ ચૂમેગી. ઉમ્મુલ મુઅમિનીન હઝરતે સય્યિ-દતુના આઈશા સિદીકَا رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهَا ફરમાતી હૈં, મદીને કે સુલ્તાન, રહમતે આ-લમિયાન, સરવરે ઝીશાન صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કા ફરમાનો આલીશાન હૈ : **أَحَبُّ الْأَعْمَالِ إِلَى اللَّهِ تَعَالَى أَدْوَمُهَا وَإِنْ قَلَّ** સબ સે પસન્દીદા અમલ વોહ હૈ જો હમેશા ક્રિયા જાએ અગર્યે કલીલ હો. (مُسْلِمٌ ص ۳۹۶ حدیث ۲۱۸)

મ-દની ઇન્આમાત કિસ કે લિયે કિતને ?

ઇસ પુર કિતન દૌર મેં આસાની સે નેક્રિયાં કરને ઔર ગુનાહોં સે બચને કે તરીકએ કાર પર મુશ્તમિલ શરીઅત વ તરીકત કા જામેઅ મજમૂઆ બનામ “મ-દની ઇન્આમાત” બ સૂરતે સુવાલાત મુરતબ ક્રિયા ગયા હૈ. ઇસ્લામી ભાઈયોં કે લિયે 72, ઇસ્લામી બહનોં કે લિયે 63, ત-લ-બએ ઇલ્મે દીન કે લિયે 92, દીની તાલિબાત કે લિયે 83, મ-દની મુન્નોં ઔર મ-દની મુન્નિયોં કે લિયે 40 જબ કે ખુસૂસી ઇસ્લામી ભાઈયોં કે લિયે 27 મ-દની ઇન્આમાત હૈં. બે શુમાર ઇસ્લામી ભાઈ, ઇસ્લામી બહનેં ઔર ત-લબા મ-દની ઇન્આમાત કે મુતાબિક અમલ કર કે રોઝાના સોને સે કબ્લ “ફિકે મદીના કરતે હુએ” યા’ની અપને આ’માલ કા જાએઝા લે કર મ-દની ઇન્આમાત કે “જેબી સાઈઝ રિસાલે” મેં દિયે ગએ ખાને પુર કરતે હૈં. ઇન મ-દની ઇન્આમાત કો ઇખ્લાસ કે સાથ અપના લેને કે બા’દ નેક બનને ઔર ગુનાહોં સે બચને કી રાહ મેં હાઈલ રુકાવટે અલ્લાહ عَزَّوَجَلَّ કે ફઝલો કરમ સે અકસર દૂર હો જાતી હૈં ઔર ઇસ કી બ-ર-કત સે اَلْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ પાબન્દે સુન્નત બનને,

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જિસ ને મુઝ પર દસ મરતબા સુબહ ઓર દસ મરતબા શામ દુરૂદે પાક પઢા
 ઉસે ક્રિયામત કે દિન મેરી શકાઅત મિલેગી. (અંગૂઠા)

ગુનાહોં સે નફરત કરને ઓર ઈમાન કી હિફાઝત કે લિયે કુઢને કા ઝેહન ભી બનતા હૈ. સભી કો ચાહિયે કે બા કિરદાર મુસલમાન બનને કે લિયે મક-ત-બતુલ મદીના કી કિસી ભી શાખ સે મ-દની ઈન્આમાત કા રિસાલા હાસિલ કરેં ઓર રોઝાના ફિકે મદીના (યા'ની અપના મુહા-સબા) કરતે હુએ ઈસ મેં દિયે ગએ ખાને પુર કરેં ઓર હિજરી સિન કે મુતાબિક હર મ-દની યા'ની ક-મરી માહ કે ઈબ્તિદાઈ દસ દિન કે અન્દર અન્દર અપને યહાં કે ઝિમ્મેદાર કો જમ્મ કરવાને કા મા'મૂલ બનાએં.

તૂ વલી અપના બના લે ઉસ કો રબ્બે લમ યઝલ

“મ-દની ઈન્આમાત” પર કરતા હૈ જો કોઈ અમલ

(વસાઈલે બખ્શિશ, સ. 608)

صَلُّوْا عَلَی الْحَبِیْب! صَلَّی اللہُ تَعَالٰی عَلَی مُحَمَّد

આમિલીને મ-દની ઈન્આમાત કે લિયે બિશારતે ઉમ્મ

મ-દની ઈન્આમાત કા રિસાલા પુર કરને વાલે કિસ કદર ખુશ કિસ્મત હોતે હૈં ઈસ કા અન્દાઝા ઈસ મ-દની બહાર સે લગાઈયે યુનાન્થે હૈદરઆબાદ (બાબુલ ઈસ્લામ સિન્ધ) કે એક ઈસ્લામી ભાઈ કા કુછ ઈસ તરહ હલ્ફિયા (યા'ની કસમિયા) બયાન હૈ કે માહે ર-જબુલ મુરજ્જબ 1426 સિ.હિ. કી એક શબ મુઝે ખ્વાબ મેં મુસ્તફા જાને રહમત صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી ઝિયારત કી અઝીમ સઆદત મિલી. લબહાએ મુબા-રકા કો જુમ્બિશ હુઈ ઓર રહમત કે ફૂલ ઝડને લગે, ઓર મીઠે બોલ કે અલ્ફાઝ કુછ યૂં તરતીબ પાએ : જો ઈસ માહ રોઝાના પાબન્દી સે મ-દની ઈન્આમાત સે મુ-તઅલ્લિક ફિકે મદીના કરેગા, અલ્લાહ عَزَّ وَجَلَّ ઉસ કી મગ્ફિરત ફરમા દેગા.

ફરમાને મુસ્તફા ﷺ : جِس کے پاس میرا ٹیک ہوا اور اُس نے مجھ پر دُرُودِ شَرِیْف نہ پڑھا اُس نے جُکھا کی۔ (عیارِ رِزاق)

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! બયાન કો ઈખ્તિતામ કી તરફ લાતે હુએ સુન્નત કી ફઝીલત ઓર ચન્દ સુન્નતે ઓર આદાબ બયાન કરને કી સઆદત હાસિલ કરતા હૂં. તાજદારે રિસાલત, શહન્શાહે નુબુવ્વત, મુસ્તફા જાને રહમત, શમ્એ બઝમે હિદાયત, નોશએ બઝમે જન્નત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને જન્નત નિશાન હૈ : જિસ ને મેરી સુન્નત સે મહબ્બત કી ઉસ ને મુઝ સે મહબ્બત કી ઓર જિસ ને મુઝ સે મહબ્બત કી વોહ જન્નત મેં મેરે સાથ હોગા. (ابن عساکر ج ٩ ص ٣٤٣)

સીના તેરી સુન્નત કા મદીના બને આકા

જન્નત મેં પડોસી મુઝે તુમ અપના બનાના

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ عَلَى مُحَمَّدٍ

“યા રબ ! ઝેરે સબ્જ ગુમ્બદ બિઠા” કે અહારહ હુરફ કી નિસ્બત સે બૈઠને કે 18 મ-દની ફૂલ

❁ ફરમાને મુસ્તફા ﷺ : જો લોગ દેર તક કિસી જગહ બૈઠે ઓર બિગૌર ઝિકુલ્લાહ ઓર નબિય્યે કરીમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ પઢે વહાં સે મુ-તફર્રિક હો ગએ. ઉન્હોં ને નુક્સાન કિયા અગર અલ્લાહ عَزَّ وَجَلَّ ચાહે અઝાબ દે ઓર ચાહે તો બખ્શ દે (١٨٦٩ حدیث ٦٨ ص ٢٤) ❁ اَلْمُسْتَدْرَكُ لِلْحَاكِمِ ج ٢ ص ١٨٠ حدیث ٦٢٧٢) ઇઝરતે સચ્ચિદુના ઇબને ઉમર જનાબે રહમતુલ્લિલ આ-લમીન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કો કા'બે શરીફ કે સોહ્ન મેં ઇહ્તિબા કી સૂરત મેં તશરીફ ફરમા દેખા. (بُخَارِي ج ٤ ص ١٨٠ حدیث ٦٢٧٢) ઇહ્તિબા કા મતલબ યેહ હૈ કે આદમી સુરીન કે બલ બૈઠે ઓર અપની દોનોં² પિંડલિયોં કો દોનોં² હાથોં કે હલ્કે મેં લે લે. ઇસ કિસ્મ કા બૈઠના તવાઝોઅ (યા'ની આજિઝી વ ઈન્કિસારી) મેં

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર રોજે જુમુઆ દુરુદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરુંગા. (કુઝાઅલ)

શુમાર હોતા હૈ (મુલખ્ખસ અઝ બહારે શરીઅત, જિ. ૩, સ. 432) ❀ ઈસ દૌરાન બલ્કે જબ ભી બૈઠેં પર્દેં કી જગહોં કી હૈઅત વ કૈફિયત નઝર નહીં આની ચાહિયે, લિહાઝા “પર્દેં મેં પર્દા” કે લિયે ઘુટનોં સે કદમોં તક ચાદર ડાલ લી જાએ અગર કુરતા સુન્નત કે મુતાબિક હો તો ઉસ કે દામન સે ભી “પર્દેં મેં પર્દા” કિયા જા સકતા હૈ ❀ હુઝૂરે પુરનૂર, શાફેએ યૌમુન્નુશૂર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ જબ નમાઝે ફજ પઢ લેતે ચાર⁴ ઝાનૂ (યા’ની ચોકડી માર કર) બૈઠે રહતે, યહાં તક કે સૂરજ અચ્છી તરહ તુલૂઅ હો જાતા (ابو داؤد ج ٤ ص ٣٤٥ حديث ٤٨٠٠) ❀ જામેએ કરામાતે ઔલિયા જિલ્દ અવ્વલ કે સફહા 67 પર હૈ : ઈમામ યૂસુફ નબહાની قُدِسَ سِرُّهُ السُّودَانી કી દો² ઝાનૂ (યા’ની જિસ તરહ નમાઝ મેં અત્તહિયાત મેં બૈઠતે હૈં ઈસ તરહ) બૈઠને કી આદતે કરીમા થી ❀ નમાઝ કે બાહર (યા’ની ઈલાવા) ભી દો² ઝાનૂ બૈઠના અફઝલ હૈ (મિરઆત, જિ. 8, સ. 90) ❀ સરવરે કાએનાત, શાહે મૌજૂદાત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઉમૂમન કિબ્લા રૂ હો કર બૈઠતે થે (احياء العلوم ج ٢ ص ٤٤٩) ❀ ફરમાને મુસ્તફા ﷺ હૈ : “મજલિસ મેં સબ સે મુકર્રમ (યા’ની ઈઝ્ઝત વાલી) મજલિસ (યા’ની બૈઠના) વોહ હૈ જિસ મેં કિબ્લે કી તરફ મુંહ કિયા જાએ” (طبرانی أوسط ج ٦ ص ١٦١ حديث ٨٣٦١) ❀ હઝરતે સચ્ચિદુના અબ્દુલ્લાહ બિન ઉમર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا અક્સર કિબ્લે કો મુંહ કર કે બૈઠતે થે (المقاصد الحسنة ص ٨٨) ❀ મુબલ્લિગ ઔર મુદરિસ કે લિયે દૌરાને બયાન વ તદરીસ સુન્નત યેહ હૈ કે પીઠ કિબ્લે કી તરફ રખેં તા કે ઈન સે ઈલ્મ કી બાતેં સુનને વાલોં કા રુખ જાનિબે કિબ્લા હો સકે યુનાન્ચે હઝરતે સચ્ચિદુના અલ્લામા હાફિઝ સખાવી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ફરમાતે હૈં : નાબિય્થે કરીમ

﴿البريق﴾ इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पाक की कसरत करो बेशक ये छ तुम्हारे लिये तछारत है.

क़िबले को ँस लिये पीठ इरमाया करते थे के आप صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ जिन्हें ँल्म सिखा रहे हैं या वा'ज इरमा रहे हैं उन का रूप क़िबले की तरफ़ रहे ﴿الْمَقَامُ الْحَسَنُ ص ८८﴾ छउरते सय्यिदुना अनस से रिवायत है **बैथैन** ढिलों के यैन, रहमते दारैन, सरवरे कौनैन صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को कल्मी न देखा गया के अपने छम नशीन के सामने घुटने झैला कर बैठे छों (ترمذی ج ६ ص २२१ حدیث २६१८) छढीसे पाक में “रुकबतैन” (या'नी घुटने) का लफ़्ज है ँस से मुराद अेक कौल के मुताबिक “दोनों² पाँउं” हैं जैसा के मुफ़स्सिरे शहीर छकीमुल उम्मत छउरते मुफ़्ती अछमद यार ખान عَلَيْهِ رَحْمَةُ الْخَنَانِ ँस छढीसे पाक के तहत इरमाते हैं : या'नी छुजूर अन्वर صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآलِهِ وَسَلَّمَ कल्मी क़िसी मजलिस (या'नी बैठक) में क़िसी की तरफ़ पाँउं झैला कर नहीं बैठते थे, न औलाद की तरफ़ न अज़्वाजे पाक की तरफ़ न गुलामों खादिमों की तरफ़ (मिरआत, जि. 8, स. 80) छउरते सय्यिदुना ँमामे आ'जम अबू छनीफ़ा عَلَيْهِ رَحْمَةُ اللهِ تَعَالَى इरमाते हैं : मैं ने कल्मी अपने उस्ताद मोछतरम छउरते सय्यिदुना छम्माद عَلَيْهِ رَحْمَةُ اللهِ الْجَوَاد के मकाने आलीशान की तरफ़ पाँउं नहीं झैलाअे उन के अेछतिराम और उन के ँकराम की वजह से, आप (या'नी उस्ताअे गिरामी كُدَس سَيِّدُ السَّامِي के घर मुबारक और मेरी रिछाँश गाछ में यन्द गदियों का झसिला छोने के आ वुजूद मैं ने कल्मी उधर पाँउं नहीं झैलाअे. (منالقب الامام الاعظم ابى حنيفة للموفق حصه २ ص ७) **आने वाले के लिये सरकना** (भिसकना) सुन्नत है : बछारे शरीअत जिहद 3 सफ़्छा 432 पर छढीस नम्बर 6 है : अेक शप्स रसूलुल्लाछ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की भिदमत में छजिर हुवा और छुजूर (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) मस्जिद

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : તુમ જહાં ભી હો મુઝ પર દુરૂદ પઢો કે તુમહારા દુરૂદ મુઝ તક પહોંચતા હૈ. (ટરૂન)

મેં તશરીફ ફરમા થે. ઉસ કે લિયે હુઝૂર (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) અપની જગહ સે સરક ગએ ઉસ ને અઝ ક્રિયા, યા રસૂલલ્લાહ ! (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) જગહ કુશાદા મૌજૂદ હૈ, (હુઝૂર (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآલِهِ وَسَلَّمَ) કો સરકને ઔર તકલીફ ફરમાને કી ઝરૂરત નહીં) ઇશાદ ફરમાયા : મુસ્લિમ કા યેહ હક હૈ કે જબ ઉસ કા ભાઈ ઉસે દેખે, ઉસ કે લિયે સરક જાએ (شَقَبُ الْإِيمَانِ ج ٦ ص ٤٦٨ حديث ٨٩٣)

❁ ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હૈ : “જબ તુમ મેં સે કોઈ સાએ મેં હો ઔર ઉસ પર સે સાયા રુખ્સત હો જાએ ઔર વોહ કુદૂ ધૂપ કુદૂ છાઉં મેં રહ જાએ તો ઉસે યાહિયે કે વહાં સે ઉઠ જાએ” (٤٨٢١ حديث ٣٣٨ ج ٤ ص ٤٠٤)

❁ મેરે આકા આ'લા હઝરત ઇમામ અહમદ રઝા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن અહમદ રઝા ખાન લિખતે હૈં : પીર વ ઉસ્તાઝ કી નિશસ્ત (યા'ની બૈઠને કી જગહ) પર ઉન કી ગૈબત (યા'ની ગૈર મૌજૂદગી) મેં ભી ન બૈઠે (ફતાવા ર-ઝવિયા, જિ. 24, સ. 369, 424)

❁ જબ કભી ઇજતિમાઅ યા મજલિસ મેં આએ તો લોગોં કો ફલાંગ કર આગે ન જાએ જહાં જગહ મિલે વહીં બૈઠ જાએ ❁ જબ બૈઠે તો જૂતે ઉતાર લેં, આપ કે કદમ આરામ પાએંગે (الصَّغِيرُ ص ٤٠٤ حديث ٥٠٥)

❁ મજલિસ (યા'ની બૈઠક) સે ફારિગ હો કર યેહ દુઆ ત્રીન³ બાર પઢ લેં તો ખતાએ મિટા દી જાતી હૈં ઔર જો ઇસ્લામી ભાઈ મજલિસે ખૈર વ મજલિસે ઝિક મેં પઢે તો ઉસ કે લિયે ઉસ ખૈર (યા'ની અચ્છાઈ) પર મોહર લગા દી જાએગી. વોહ દુઆ યેહ હૈ :

“سُبْحٰنَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ”

(ابوداؤد ج ٤ ص ٣٤٧ حديث ٤٨٥٧)

1 : તરજમા : તેરી ઝાત પાક હૈં ઔર ઐ અલ્લાહ ! عَزَّ وَجَلَّ લિયે તમામ ખૂબિયાં હૈં, તેરે સિવા કોઈ મા'બૂદ નહીં, તુઝ સે બખ્શિશ યાહતા હું ઔર તેરી તરફ તૌબા કરતા હું.

કરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर दस भरतभा दुर्रहे पाक पढा अल्लाह उंस पर सो
रहमतें नाज़िल करमाता है. (अब्रार)

હઝારોં સુન્નતોં સીખને કે લિયે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ દો² કુતુબ (1) 312 સફહાત પર મુશ્તમિલ કિતાબ “બહારે શરીઅત” હિસ્સા 16 ઓર (2) 120 સફહાત કી કિતાબ “સુન્નતોં ઓર આદાબ” હદિથ્યતન હાસિલ કીજિયે ઓર પઢિયે. સુન્નતોં કી તરબિથ્યત કા એક બેહતરીન ઝરીઆ દા’વતે ઇસ્લામી કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં ભરા સફર ભી હૈ.

લૂટને રહમતેં કાફિલે મેં ચલો સીખને સુન્નતેં કાફિલે મેં ચલો
હોંગી હલ મુશિકલેં કાફિલે મેં ચલો ખત્મ હોં શામતેં કાફિલે મેં ચલો
صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ



તાલિબે ગમે મદીના
વ બકીઅ વ મગ્કિરત
વ બે હિસાબ જન્નતુલ
ફિરદોસ મેં આકા
કા પડોસ



18 ર-જબુલ મુરજજબ 1433 સિ.હિ.
9-6-2012

યેહ રિસાલા પઢ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તકરીબાત, ઇજતિમાઆત, આ’રાસ ઓર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કદર્દા રસાઈલ ઓર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેશ્લેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિચ્યતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા’મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેશ્લેટ પહોંચા કર નેકી કી દા’વત કી ધૂમેં મચાઈયે ઓર ખૂબ સવાબ કમાઈયે.

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : જિસ કે પાસ મેરા ઝિક હો ઓર વોહ મુઝ પર દુરુદ શરીફ ન પઢે તો વોહ લોગોં મેં સે કન્જૂસ તરીન શખ્સ હૈ. (ઝીબૈયૈ)

ફેહરિસ

ઉન્વાન	સંક્ર્ધ	ઉન્વાન	સંક્ર્ધ
દુરુદે પાક કી ફઝીલત	1	કોઈ ડાંટ કર તો દિખાએ !	14
ભયાનક ઊંટ	1	આસાનિયોં કે બા વુજૂદ સુસ્તી	15
વાહ રે ! શાને બે નિયાઝી	2	હાએ ! મુસલમાનોં કા બિગડા હુવા ફિરદાર !	15
આકાએ મઝલૂમ કો સતાને કા સબબ	3	નેકી કી દા'વત કી ફઝીલત વ અ-ઝમત	16
કોહે સફા સે નેકી કી દા'વત	3	બા વુજૂદે કુદરત ગુનાહ સે ન રોકને વાલે કે લિયે વઈદ	16
દરવાઝે પર ખૂન	4	40 હઝાર અચ્છે ભી હલાક કરૂંગા કયૂંકે	17
રાહે ખુદા મેં મુસીબત ઝેલના સુન્નત હૈ	5	નેકી કી દા'વત કે લિયે સફર કરના સુન્નત હૈ	18
શિ'બે અબી તાલિબ	6	ઈલ્મ કે ફઝાઈલ મેં ચાર ફરામીને મુસ્તફા	19
સમાજી કત્એ તઅલ્લુક (સોશયલ બાયકાટ)	7	અમીર શાફિવા કે હુને અખ્વાક ને મુઝે મ-દની શાફિલે કા મુસાફિર બના ડિયા	20
ચમરો કા ટુકડા ખા લિયા	8	ઈસ્તિકામત બહુત ઝરૂરી હૈ	22
દીમક કા કમાલ	9	મ-દની ઈન્આમાત કિસ કે લિયે કિતને ?	23
તાઈફ કા લરઝા ખૈઝ સફર	10	આમિલીને મ-દની ઈન્આમાત કે લિયે બિશારતે ઉઝ્મા	24
કલમ કાંપતા હૈ !	11	બૈઠને કે 18 મ-દની ફૂલ	25
પહાડોં કા ફિરિશ્તા	13	☆☆☆☆☆	

ۛرمانے مۇستفأ لله وسلم عليه و آله وسلم : (س شمس كى ناك ناك آلاؤء ءو ءس كے پاس مءرا ءك ءو اور وءء
مۇن ۛر ءؤء ۛك ن ۛءء . (ءمء)

مآخذ ومراجع

مطبوعه	كتاب	مطبوعه	كتاب
دارالكتب العلمیة بیروت	سبل الھدی	مكتبة المدینة باب المدینة كراچی	كنز الایمان
كوبئء	مناقب الامام الاعظم الی حنیفة	دارالكتب العلمیة بیروت	التفسیرات الاحمءیة
ضیاء القرآن پبلی كیشنز مركز الاولیاء لاھور	سیرت رسول عربی	دارالكتب العلمیة بیروت	صحیح بخاری
مركز الھلسنت یركات رضا	جامع كرامات اولیاء	دارالمن تزام بیوت	صحیح مسلم
دارالكتب العلمیة بیروت	القول البدیع	دارالفكر بیروت	سنن ترمذی
دارالكتب العلمیة بیروت	المواهب اللدنیة	داراحیاء التراث العربی بیروت	سنن ابوداود
دارالكتب العلمیة بیروت	بستان الواعظین	دارالمعرفة بیروت	مستدرک
دارالكتب العلمیة بیروت	السیرة النبویة	دارالكتب العلمیة بیروت	شعب الایمان
دارالكتب العلمیة بیروت	الخصائص الكبری	داراحیاء التراث العربی بیروت	مجم كبیر
دارالكتب العلمیة بیروت	المرض اللانف	دارالكتب العلمیة بیروت	مجم اوسط
دارصادر بیروت	احیاء العلوم	المكتبة العصریة بیروت	الامر بالمعروف والنهی عن المنكر
ضیاء القرآن پبلی كیشنز مركز الاولیاء لاھور	مرآة المناجیح	دارالكتب العلمیة بیروت	الترغیب والترہیب
رضافاؤنڈیشن مركز الاولیاء لاھور	فتاوی رضویة	دارالكتب العلمیة بیروت	الجامع الصغیر
مكتبة المدینة باب المدینة كراچی	بہار شریعت	دارالكتب العلمیة بیروت	حلیة الاولیاء
مكتبة المدینة باب المدینة كراچی	وسائل بخشش	دارالفكر بیروت	تاریخ دمشق
☆☆☆	☆☆☆	دارالكتاب العربی بیروت	المقاصد الحسنة